

## ૬ જુલાઈ ૨૦૨૫થી આરંભ થતા ચાતુર્માસના વિશેષ નિયમો

પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેખજીને રાજુ કરવાના એકમાત્ર ભાવથી તેઓએ આપેલા આ વિશેષ નિયમો  
યથાશ્રદ્ધા તથા યથાશક્તિ આચરણમાં મૂકવા પ્રભુના તથા ગુરુહરિના ખણની યાચના કરીએ.

૧. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનુસાર રોજ નાહી-ધોઈને પ્રભુની પૂજા કરવી. તેમાં ‘શિક્ષાપત્રી’ના પાંચ શ્લોકોનું વાંચન કરવું. પ્રાર્થના કરવીકે, ‘આપે આપેલા નિયમ-ધર્મની મર્યાદામાં રહીને ભક્તિ કરીએ અને સધળાં કામ પણ કરીએ.’
૨. પૂજા કરી શ્રી શાહકોરજીની મૂર્તિને પ્રાણામ કરી આપણા ઘર-પરિવારમાં આપણાં વડીલોના ચરણસ્પર્શ કરી, ‘જ્ય શ્રી સ્વામિનારાયણ’ કહી, તેઓના આશીર્વાદની યાચના કરવી. દરરોજ ઘરનાં વડીલોની કાળજી લેવી, તેઓની સારસંભાળ રાખી, તેઓ રાજુ થાય તેવી રીતે તેઓની સેવા કરવી.
૩. બ્રહ્મસ્વરૂપ યોગીબાપાની આજ્ઞાનુસાર અઠવાડિક સત્સંગસભામાં અવશ્ય દ્વાજરી આપવી. સભા ન થતી હોય તો આપણો શરૂ કરવી, સૌને બોલાવવાં. અઠવાડિક સત્સંગસભા ઉપરાંત અઠવાડિયામાં બે વખત ઘરનાં સૌ પરિવારજનોએ બેગાં મણી ઘરસભા અવશ્ય કરવી.
૪. ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત ‘શ્રી વચનામૃત’ માંથી દરરોજ એક વચનામૃતનું વ્યક્તિગત અથવા પરિવારમાં પઠન અથવા શ્રવણ અને મનન કરી તેને જીવનના આચરણમાં મૂકવા પ્રભુ તથા ગુરુહરિને પ્રાર્થના કરી તેઓનાં બળની યાચના કરવી.
૫. મહિનાની દરેક અઠવાડિક સત્સંગસભામાં ‘બ્રહ્મનિર્જર’ પત્રિકાનું વાંચન કરવું.
૬. સૌ સત્સંગીઓએ પ્રભુ અને ગુરુહરિની સ્મૃતિ સાથે શેષ જીવનપર્યત અને સવિશેષપણે પવિત્ર ચાતુર્માસ દરમિયાન દરરોજ અદ્યો કલાક ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરવી.
૭. પવિત્ર ચાતુર્માસ દરમિયાન પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ આવે અને દાક્તરી સલાહ/અનુમતિ હોય તો, એકટાણાં કરવાં; અથવા ઓછામાં ઓછું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એકટાણાં કરવાં.
૮. સૌ યુવા (બહેનો-ભાઈઓ) તથા યુવા સાધકો ચાતુર્માસ દરમિયાન એક માસના અથવા ઓછામાં ઓછા પંદર દિવસનાં ધારણાં પારણાંના વિશે ખ નિયમ લઈ, આત્મ દરમિયાન પોતાનાં સર્વ વિચાર, વાણી અને વર્તન પ્રભુ અને ગુરુહરિ રાજુ થાય તેવાં રાખવાં વિશે ખ જગતતા રાખે.
૯. શેષ જીવનપર્યત અને સવિશેષપણે પવિત્ર ચાતુર્માસ દરમિયાન પ્રભુ અને ગુરુહરિને રાજુ કરવા સૌ સત્સંગીઓ આધ્યાત્મિક તપસ્યાનો આ એક નિયમ અવશ્ય ધારણા કરે અને તેનું જગતતા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરે : સદાય સૌના ગુણ ગાવા-સાંભળવા-જોવા, પરંતુ, કોઈનાં પણ અમહિમા-અભાવ-ભાવફેર કે નકારાત્મક ટીકાટિપણથી દૂર જ રહેવું.
૧૦. ચાતુર્માસ વિશે ખ અને શેષ જીવન દરમિયાન આપણી નિત્ય પ્રાતઃ પૂજામાં પ્રાર્થના કરવી :  
 હે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન ! હે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનં સ્વામીજી ! હે પ્રભુનાં સર્વ સાકાર, દિવ્ય ગુણાતીત સ્વરૂપો !  
 હે પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેખજી ! અમારા મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે. અમારા ગુરુ તથા પ્રગટ ગુરુહરિની પ્રસરતા અર્થે ગુરુઆજાથી અમે જે સેવા કે પ્રવૃત્તિમાં જોડાઈએ તેમાં ફરિયાદ કર્યા વિના, સૌ સાથે સંપ-સુહંદભાવ અને એકતા જગવી, પ્રભુનું કાર્ય પ્રભુની રીતે પ્રભુ અને ગુરુહરિ રાજુ થાય તેવી રીતે કરીએ.  
 હે પ્રભુ ! હે ગુરુહરિ ! અમારું જીવન ગુરુહરિ શાશ્વીજી મહારાજ, ગુરુહરિ યોગીજી મહારાજ તથા આપના દિવ્ય કાર્યના વાહકરૂપ અને શ્રી અક્ષરપુરુષોના ઉપાસનાનાં આચરણ દ્વારા પરમ દિવ્ય બની રહે તેવા આ સંકલ્પ સાકાર થાય તે માટે આપની કૃપા અને બળની પ્રાર્થના સાથે ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રની શ્રદ્ધાપૂર્વક અને ગુરુહરિની સ્મૃતિ સાથે ધૂન કરીએ છીએ.

**ઉં સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...!**